

## પાઠ ૨૭: જૈન દર્શનમાં યોગનો વિચાર

આજના સમયમાં જે આપણે યોગ કહીએ તો એમ સમજાય કે આસન વગેરે પ્રકારની શરીરની કસારત જેનાથી મન અને તનની તંદુરસ્તી બરાબર રહે છે અને રોગો દૂર રહે છે. પરંતુ, હકીકતમાં ભારતીય ફિલસ્ફ્યુઝિનમાં યોગ સંસ્કૃત શાષ્ટ છે. ચુજ એટલે જોડાણ. એ એક પ્રકારની આધ્યાત્મિક કિયા છે જેમાં આત્માની પરમાત્મા સાથે જોડાણની ફિલસ્ફ્યુઝિ છે. પતંજલિ ઋષી એ કહ્યું હતું કે મન જે નિરંતર ભટકતું રહે છે, તે સ્થિર રહેતે યોગનો અર્થ છે. પતંજલિએ પોતાના આ અવિરત કાર્યમાં ૮ જરૂરી વિભાગ અથવા પગાથિયા યોગ વિશે આપેલ છે. જે ચમણી સમાધિ તરફ લઈ જાય છે જ્યાં તન, મન અને આત્મા એકદમ શાંત અને સ્થિર થાય છે. પતંજલી યોગના મુખ્ય ૮ ભાગ છે જેને અષ્ટંગ યોગ કહેવાય છે.

- ૧) યમ - સિદ્ધાંતો
- ૨) નિયમ - આચારણના નિયમો
- ૩) આસન - વિવિધ પ્રકારની શરીરની અવસ્થા તન અને મન સ્થિર કરવા માટે
- ૪) પ્રાણાયમ - શ્વાસ પર નિયંત્રણ
- ૫) પ્રત્યાહાર - શુભ ભાવના
- ૬) ધારણા - મનની સ્થિરતા
- ૭) ધ્યાન - ધ્યાન કેન્દ્રિત કરવું, ઊંડું ધ્યાન
- ૮) સમાધિ - મન, તન, આત્માની સર્વોચ્ચ શાંતિ

આ બધા સ્થળ અર્થ છે પણ તેની અંદરનું ઊંડું જ્ઞાન અદ્ભુત છે. એટલું પ્રબળ છે કે તે મુક્તિ સુધી દોરી જાય છે. આ પદ્ધતિ શાસ્ત્રીક, માનસિક અને આધ્યાત્મિક તંદુરસ્તી માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ થઇ રહી છે. આ પ્રસિદ્ધ અમાન્ય નથી પરંતુ યોગનો જૈન દ્રષ્ટિકોણ શું છે તે જોઇએ.

### જૈન યોગઃ

જૈન દર્શન પ્રમાણે આત્મામાં થતી સ્કુરણાને વ્યક્ત કરવાના સાધનને યોગ કહેવાય (મન, વચન, કાયાની પ્રવૃત્તિ) છે. યોગ ઉપર કંટ્રોલ આત્માનો છે પણ આત્મ શક્તિ પ્રગાટ કરવા યોગની જરૂર પણ છે. યોગને સ્થિર કરવા ધ્યાન છે. મોક્ષ માટે પણ યોગની આવશ્યકતા છે.

ધ્યાનના દ્રષ્ટિકોણથી જોઇએ તો તિર્થકર આદિનાથથી લઈને તિર્થકર મહાવીર સુધીના બધા યોગી હતા. પરંતુ શુદ્ધાત્મા અયોગી છે. યોગ કર્મના આશ્રવ, બંધ, સંવર અને નિર્જરાના કારણ છે માટે યોગ એ છોડવાની વસ્તુ છે એવો સામાન્ય બોધ જૈન ધર્મ પ્રમાણે થાય. આ મુંગવણ ને દૂર કરવા આચાર્ય હરીભદ્રસુરીજીએ યોગની યોગ્ય વ્યાખ્યા આપી છે. તેમણે જૈન યોગ વિશે ઘણાપુસ્તકો લખ્યા છે અને જૈન યોગ સાથે પતંજલી યોગની સરખામણી કરી છે. યોગ બિંદુ, યોગ દ્રષ્ટી સમુચ્ચય,

યોગવિંશિકા વગેરે ગ્રંથો ધ્વારા તેમણે જૈન ધર્મના યોગની સ્પષ્ટ સમજણા અને દિશા આપી છે. હર્ચીભરસુરીજી પછી પણ મહાન આચાર્યો જેવા કે હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી, મહાપ્રફાજી વગેરેએ પણ જૈન યોગના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું છે.

નવ તત્ત્વ અને રત્નગ્રંથી ને નજરમાં રાખી પાયોબનાવી ને બધી કિયાઓ જે મુક્તિ તરફ લઇ જાય તે જૈન યોગનો ભાગ છે. સંવર, નિર્જરા, શ્રાવકાચાર, શ્રમણાચાર, શુભ ધ્યાન, તપ, અનુપ્રેક્ષા વગેરે બધુજ જૈન યોગનો ભાગ છે.

પતંજલિએ યમ થી શરૂ કરી સમાધિ સુધી મુક્તિ માર્ગ બતાવ્યો છે, એવી રીતે, હર્ચીભરસુરીજીએ અષ્ટાંગ દ્રષ્ટિનો માર્ગ આપ્યો છે જે મિત્રા દ્રષ્ટિ થી શુરૂ થઈ પારા દ્રષ્ટિ પર પૂરી થાય છે. અષ્ટાંગ દ્રષ્ટિમાં વ્યક્તિ સાચી શ્રદ્ધાથી ઉપર ચડી સાચું જ્ઞાન પ્રાપ્ત કરી સાચું આચરણ કરે છે. મિથ્યાત્વથી સમયકૃત્વ તરફ પ્રગતિ કરે છે જે મુક્તિમાં પરિણમે છે.

અષ્ટંગ યોગ અને હરીભદ્રસુરીજી અષ્ટંગ દ્રષ્ટિ (આઠ પ્રકારની પ્રભા-પ્રકાશ) નો સંબંધ :

અષ્ટંગ યોગ	અષ્ટંગ દ્રષ્ટિ	આયવસ્થાના વ્યક્તિત્વના ગુણા	સમયકાળ
૧ યમ	મિત્રા	અણુગ્રત પાળવાની ઈચ્છા	ઘાસના તણખલામાં આગા રહે ત્યાં સુધી
૨ નિયમ	તારા	ધર્મ ગમવાલાગે, શ્રદ્ધા વધે	છાણમાં અર્થિન રહે ત્યાર સુધી
૩ આસન	બલ	શ્રદ્ધા વધે, જિનવાણી સાંભળવાની ઈચ્છા થાય	લાકડામાં આગા રહે ત્યાં સુધી
૪ પ્રાણાયમ	દિપ્રા	ધર્મની શ્રદ્ધા કાયમ પણ આચરણ ઓળું	દીવામાં જ્યાં સુધી ધી અને તેલ હોય અને અર્થિન રહે ત્યાં સુધી

આપણે બધા સામાન્ય રીતે ૧ થી ૪ ના સ્તર પરજ હોઇએ છીએ જેમાં વધતી ઘટતી શ્રદ્ધા અને આચરણ છે. પરંતુ જ્યાં સ્તર પછી મુક્તિની યાત્રા શરૂ થાય છે.

૫ પ્રત્યાહાર	સ્થિર	મહાગ્રત પાળે છે, કષાય મંદ પડે, ઇન્દ્રિય સંયમ(સમક્ષિતજ્ઞવ)	હીરાના તેજ જેવું
૬ ધારણા	કાંત	સંપૂર્ણ જાગૃતી સાથે મહાગ્રત સાતમું ગુણ સ્થાન(અપ્રમત)	તારાના તેજ જેટલું
૭ ધ્યાન	પ્રભા	સૂક્ષ્મ કષાય	સૂર્યના તેજ જેટલું
૮ સમાધિ	પારા	સયોગી - કેવલી - સર્વજ્ઞ	ચંદ્રના તેજ જેવું

આવી રીતે આચાર્ય હરીભદ્રસુરી એ જૈન યોગનો અર્થ સમજાવ્યો. યોગ ફક્ત આશ્રવ અને બંધ નહીં પણ સંવર, નિર્જરા અને મોક્ષનું પણ કારણ છે. આ ઉપરાંત મન, વચન, કાયાની પ્રવૃત્તિ એટલે કે યોગ ઉપર આહાર, ક્ષેત્ર, કાળ, નિમિત, દ્રવ્ય વગેરેથી અસર થાય તે પણ સમજાવ્યું છે.